

IIT-GN માં ભારતીય ઉપખંડોમાં ભાગલા પર ચર્ચા

હૈદરાબાદ યુનિ.ના પ્રો.સંજય પાલશિકર ખાસ
વક્તવ્ય આપવા માટે આવશે.

SEMINAR

સિટી રિપોર્ટર : અમદાવાદ

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ
ટેકનોલોજી, ગાંધીનગરનાં
સોસાયટી અને કલ્ચર વિષયનાં
એમએનાં ફેકલ્ટી અને સ્ટુડન્ટ્સ
દ્વારા 'ભારતીય ઉપખંડોમાં
ભાગલા' વિષય પર એક દિવસનો
વર્કશોપ ગુરુવારે યોજાશે.
આ વર્કશોપમાં ભાગલાઓને
લગતાં જુદા-જુદા વિષયો જેવાં કે
રાષ્ટ્રીયતા, નાગરિકતા, ભાગલાનાં

સાક્ષીઓ, વર્ગિક રાજનિતી,
સ્થળાંતર, લિંગ ભેદ અને અન્ય
વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો
છે. જેમાં હૈદરાબાદ યુનિવર્સિટીનાં
પોલિટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં
પ્રો.સંજય પાલશિકર દ્વારા કિનોટ
એડ્રેસ આપવામાં આવશે.

ત્યારબાદ સાંજે પાંચથી 6
કલાકે પ્રો.સંજય પાલશિકરની નવી
બૂક 'એવિલ એન્ડ ધ ફિલોસોફી
ઓ રેટ્રિબ્યુશન: મોર્ડન કોમેન્ટ્રીઝ
ઓન ધ ભગવત-ગીતા' વિષે ચર્ચા
કરવામાં આવશે.